

ORIENTAL CARBON & CHEMICALS LIMITED

14th Floor, Tower-B, World Trade Tower, Plot No. C-1, Sector-16, Noida - 201301, UP Phone: 91-120-2446850 Email: occlnoida@occlindia.com
Website: www.occlindia.com



September 21, 2022

The Manager

BSE Limited
Phiroze Jeejeebhoy Towers

Dalal Street

Mumbai - 400 001

BSE STOCK CODE: 506579

552 51 0 CK CODE: 500

The Manager

National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex

Bandra (E)

Mumbai - 400 051

NSE SYMBOL: OCCL

Dear Sirs/Madam,

Sub: Submission of notice to the shareholders of the Company in respect of

transfer of Ordinary Shares/Dividend to the Investor Education and

Protection Fund

In compliance with Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed e-copies of public notice published on September 16, 2022, in respect of transfer of Ordinary Shares/Dividend of the Company to the Investor Education and Protection Fund in accordance with the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time, in the "Business Standard" (National Edition in English) and "Sandesh" (Bhuj Edition in Gujrati).

This is for your information and records.

Yours faithfully,

Thanking you, For ORIENTAL CARBON & CHEMICALS LTD.

Pranab Kumar Maity Company Secretary & GM Legal

Encl.: As above.

Registered Office:

Plot No. 30 - 33, Survey No. 77 Nishant Park, Nana Kapaya, Mundra, Kachchh, Gujarat -370415 CIN - L24297GJ1978PLC133845 Plants :

Plot 3 & 4 Dharuhera Industrial Estate, Phase - 1 Dharuhera - 123106, Distt. Rewarl, (Haryana)

SEZ Division : Survey No. 141, Paiki of Mouje Village Mundra Taluka Mundra, Mundra SEZ, District Kutch, Gujrat - 370421

Delhi's power play comes amid liquor revenue fall

AAP says enough money for subsidy, those who don't want it can drop out

INDIVJAL DHASMANA New Delhi, 15 September

elhi is far better financially than most states to continue freebies. Why then has it decided to allow people to opt out of the free electricity subsidy given to those consuming up to 400 units?

Any saving from the ₹3,250crore power subsidy that the Delhi government has budgeted for the current financial year will be known after the data on the options exercised by its over 5.8 million electricity consumers is known. The government has projected its revenue surplus at ₹7,601 crore this financial year, compared to the ₹3,039 crore deficit it had in the previous year (revised estimates). However, Delhi has been off the mark in estimating its revenue balance in recent times. It projected a revenue surplus of ₹7,239 crore for 2020-21 but revised it to ₹3,770 crore of revenue deficit. Later, it turned out to be ₹1.450 crore of revenue surplus, Similarly, it estimated a revenue surplus of ₹1,271 crore for 2021-22 at the time of the Budget presentation but revised it to ₹3,039 crore of revenue deficit as cited



projection of over ₹7,000 crore of revenue surplus hinges on the ₹9.454 crore it expected to earn from alcohol this financial year. The amount represented a 57.6 per cent rise from around ₹6,000 crore it had been earning from alcohol a year in recent times.

The government projected ₹700 crore from country-made spirits and ₹8,754 crore from foreign liquor and spirits for 2022-23. This sum is now uncertain after the government last month abandoned its pol

above. Also, the government's icy on alcohol. It is still not clear how bad a dent the move to revert to the old liquor policy will have on the government's finances in eight months of

According to reports, in the first quarter of 2022-23, ₹1,594.84 crore was collected from the sale of liquor. Of this, ₹980 crore is a refundable deposit. Even if the government in the entire FY23 earns the same amount-around ₹6,000 crore-it earned from alcohol in recent years, it would enue loss from scrapping of still have a gap of around new excise policy.

breakfast plan for primary students The breakfast scheme for

Stalin launches free

government school students from Class 1 to 5 was launched here on Thursday by Tamil Nadu Chief Minister M K Stalin and he served and had food with children. Stalin said the scheme would bring beneficial change in the lives of the poor people and billed the initiative as one that would earn a place in history

₹3,500 crore over the budget estimates under this head. This gap is roughly the same amount that the government expects to incur in power subsidy. AAP national spokesperson Saurabh Bharadwaj agreed that the government will get only ₹6,000 crore revenue from liquor in the current financial vear. However, he did not agree that the option given by the state government to the people to opt out of electricity subsidy has anything to do with rev-

Govt to provide subsidy to set up EV-charging infra: Power secy

Adoption and Manufacture of (Hybrid and) Electric Vehicles Scheme (FAME) to provide subsidy for setting up of upstream infrastructure to firms setting up EV charg- pay the discoms or utilities setting up ing infrastructure, Union Power Secretary Alok Kumar said on Thursday.

set up upstream infrastructure like trans-

The government will soon redraft Faster formers for providing electricity supply to EV charging stations which cost around ₹5-6 lakh. "We would give subsidy to firms setting up EV charging infrastructure to upstream infrastructure." Presently the companies setting up EV charing stations He explained that discoms or utilities are required to pay for this upstream infra-

power crisis during this festival season due to coal shortage at thermal plants as 20 million tonne of coal has already been imported so far. Last year around this time. India faced power crisis due to coal shortages at thermal plants. This had prompted the Centre to take measures to

ACCENT REGION

UTTAR PRADESH

Lucknow Metro 2.0 to cost ₹4,265 crore

Lucknow, 15 September

The proposed east-west corridor of the Lucknow Metro Rail project is estimated to cost ₹4,265 crore and complete in five years. The second phase of the city's metro

rail project will connect the more densely populated and congested old areas of the 'City of Nawabs' with Lucknow's main railway station in Charbagh area. While the 23-km north-south corri-

dor of the mass rapid transport system (MRTS) in Lucknow is already operational, the east-west corridor will span According to the UP Metro Rail

Corporation (UPMRC), the cost of the east-west corridor has escalated from ₹3,786 crore (estimated in the detailed project report (DPR) in February 2019) to ₹4,265 crore due to inflation. "The change in cost is in sync with

the current inflation rate as per government guidelines," an UPMRC spokesperson said, adding the revised DPR has been submitted to the Uttar Pradesh government for vetting and approval.

The operational north-south corridor of Lucknow Metro had cost about ₹6,880 crore. It was partly funded by debt and equity. Funds for the flagship projects mated to benefit a population of nearly were also raised from multilateral finan- 2 million.



cial entities including the European Investment Bank.

Of the total length of the east-west corridor from Charbagh to Vasant Kunj, the span of the elevated and underground track would be about 4.2 kms and 6.8 kms, respectively. The total 12 metro stations on the corridor will include seven underground and five elevated stations. The fresh DPR has been also upgraded with 750 DC traction systems, which is being installed in Kanpur and Agra metro project so as to overcome the severe OHE flashing problem being faced in Lucknow metro line owing to the tripping caused by kite fliers using metallic wires.

Meanwhile, the MRTS project in Agra, the third largest city in UP, is esti-

CHHATTISGARH 91% of targeted rice deposited in central pool

Raipur, 15 September

Chhattisgarh has deposited about 91 per cent of the rice against the target given for the central pool in the kharif marketing season (KMS) of 2021-22.

The state has deposited 5.93 million metric tonnes of custom milled rice (CMR) as on September 9 to the central pool as against the target of 6.52 million metric tonnes set for the season 2021-22, state government officials said. CMR is manufactured by milling the paddy procured by State government agencies and the Food Corporation of India (FCI).

In states like Andhra Pradesh, Telangana, Punjab, Harvana, Chhattisgarh, Odisha, MP, Tamil Nadu, Maharashtra, UP, and Bihar, paddy is mainly bought by state or state agencies. The resultant rice is delivered to the state government and FCI after getting the paddy milled. The state agencies procure paddy whereas FCI procures 70 per cent of total rice procured for the central pool.

In a first, Chhattisgarh has delivered a record quota of rice to the FCI and Civil Supplies Corporation by undertaking custom milling and paddy procurement simultaneously. After Punjab and Telangana, Chhattisgarh is the highest contributor of rice to the central pool in the current KMS.

RAJASTHAN

100K get work under urban job scheme

Jaipur, 15 September

Around 100,000 people have received jobs in less than a week of the launch of Rajasthan government's scheme to provide 100 days of employment in a year to families in urban areas, a senior official said on Thursday.

Chief Minister Ashok Gehlot launched the Indira Gandhi Shehari Rojgar Yojana on September 9 for people aged between 18 and 60 years old. So far, iob cards for more than 245,000 families have been made, and 383,639 people of these families are included in job cards.

Also, 139,798 beneficiaries from 96,452 families have demanded jobs so far. "The number is increasing. There is \mid Gandhi National Rural Employment a lot of enthusiasm about this scheme in the urban areas of the state," said a senior official of the department of local bodies that is implementing the scheme.

'The government is making endeavours that no person remains deprived of employment for livelihood," he said.

While unskilled labourers will get ₹259 per day, skilled workers will be given ₹283, and ₹271 per day has been fixed for mates, he said. The wages of the labourers are paid directly in their bank account within the prescribed period.

The official claimed that Rajasthan is the first state to launch such a scheme to provide guaranteed employment in the urban areas on the lines of Mahatma

Guarantee Scheme (MGNREGS), which proved a boon for India during the Covid-19 pandemic.

Taking a cue, Gehlot had announced in his Budget speech to start an urban employment guarantee scheme much on the lines of MGNREGS.

For this scheme, the state has a Budget provision of ₹800 crore for the financial year 2022-23. The estimated cost of identified works is approximately ₹658 crore.

The registration for the scheme is being done through Jan Aadhaar cards. There is a provision for providing employment within 15 days after the



Balmer Lawrie & Co. Ltd.

Regd. Add.: 21, Netaji Subhas Road, Kolkata -700001 CIN: L15492WB1924GOI004835

Balmer Lawrie & Co. Ltd. invites online bids against the subject tender GLS/TE22/023, Engagement of Clearing & Forwarding Agent (CFA) 07.10.2022 Engagement of Clearing & Forwarding Agent (CFA)

lawrie.eproc.in. All the revisions, clarifications, corrigenda, addenda, time extensions etc. to the above subject tenders shall be hosted on Balmer Lawrie websites only (www.balmerlawrie.com https://balmerlawrie.eproc.in). Bidders should regularly visit these websites to keep themselves updated. For any query, please contact Senior Manager (SCM), Contact No : 8199900630, E-mail ID sengupta.s@balmerlawrie.com.

ORIENTAL CARBON & CHEMICALS LIMITED

Corporate Identity Number (CIN) - L24297GJ1978PLC133845 Regd. Off: Plot No. 30-33, Survey No. 77, Nishant Park, Nana Kapaya, Mundra, Kachchh, Gujarat - 370415

Email ID: investorfeedback@occlindia.com; Website; www.occlindia.com

NOTICE

(for attention of Equity Members of the Company)

Sub.: Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund Authority (IEPF)

This Notice is hereby published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time ("the IEPF Rules"). As per Section 124(6) of the Companies Act, 2013 read with the above referred Rules, all shares in respect of which dividends declared by the Company has not been claimed or remained unpaid for seven consecutive years or more are required to be transferred by the Company to IEPF.

In accordance with the various requirements as set out in the Rules the Company has already communicated individually to the Members for shares in respect of which dividend had remained unpaid or unclaimed for a period of seven years or more for the financial year 2015-16 (Interim) under IEPF Rules and are liable to be transferred to the IEPF Authority for taking appropriate action(s). The Company has uploaded full details of such Members and shares due for transfer to the IEPF Authority on the website of the Company at www.occlindia.com.

All concerned members are further requested to encash the Interim Dividend for the financial year 2015-16 and onwards by providing requisite documents to the Company or Company's Registrar and Share Transfer Agent on or before 15th December, 2022, so that the shares are not transferred to IEPF. In case the Company or Company's Registrar and Share Transfer Agent does not receive any communication within aforesaid period, the Company shall, with a view to complying with the requirement set out in the Rules, transfer the entire shares to IEPF, without any further notice by the following due process as mentioned

- In case of shares held in Physical form: by issuing duplicate share certificates on behalf of the concerned members and then
- In case of shares held in Demat form: by transferring the shares directly to demat account of IEPF Authority with the help of Depository Participants.

Concerned Members can claim both unclaimed dividend and shares transferred to the IEPF Authority after following the procedure prescribed

In case the Members have any queries/clarifications on the subject matter and the Rules, they may contact the Company's Registrar and Transfer Agent at Link Intime India Pvt. Ltd., Room No. 502 & 503 5th Floor, Vaishno Chamber, 6, Brabourne Road, Kolkata - 700 001 Tel: +91 33 4004 9728/1698; E-mail: iepf.shares@linkintime.co.in.

The Notice may also be assessed on the Company's website at www.occlindia.com and may also be assessed on Stock Exchanges Websites at www.bseindia.com and www.nseindia.com.

For Oriental Carbon & Chemicals Limited

Dated: 15.09.2022

Pranab Kumar Maity Company Secretary & GM Legal

INVITATION FOR EXPRESSION OF INTEREST

(Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016							
RELEVANT PARTICULARS							
1							
2	Date of incorporation of corporate debtor	04th August 2004					
3	Authority under which corporate debtor is	Registrar of Companies, Mumbai					
	incorporated / registered						
4	Corporate identity number / limited liability	U27101MH2004PTC147842					
	identification number of corporate debtor						
5	Address of the registered office and	5A/5B, Trust House, Dr. E. Broges Road, Opp. Shirodkar					
	principal office (if any) of corporate debtor	High School, Parel (East) Mumbai Mumbai City					
_	land to the second seco	MH 400012 IN 02nd June 2022					
6	Insolvency commencement date of the corporate debtor	02nd June 2022					
7	Date of invitation of expression of interest	16th September 2022					
8	Eligibility for resolution applicants under	For the detailed EOI and eligibility criteria, please contact					
ľ	section 25(2)(h) of the Code is available	on cirp.shahbrothers@rirp.co.in or					
	at:	caamith.gupta@gmail.com					
9	Norms of ineligibility applicable under	For the Norms of ineligibility applicable under section					
	section 29A are available at:	29A, please contact on cirp.shahbrothers@rirp.co.in					
		or caamith.gupta@gmail.com					
10	Last date for receipt of expression of	16th October 2022					
	interest						
11	Date of issue of provisional list of	26th October 2022					
	prospective resolution applicants						
12	Last date for submission of objections to	31st October 2022					
	provisional list						
13	Date of issue of final list of prospective	10th November 2022					
	resolution applicants	04 + 0 + 1 + 0000					
14	Date of issue of information memorandum,	31st October 2022					
	evaluation matrix and request for resolution plans to prospective resolution applicants						
15	Manner of obtaining request for resolution	The Resolution Professional shall share the documents					
	plan, evaluation matrix, information	through e-mail or virtual data room after verification of					
	memorandum and further information	KYC documents and eligibility criteria under section 29A					
		of Insolvency and Bankruptcy Code, 2016 and					
		prequalification criteria as approved by the Committee of					
		Creditors.					
16	Last date for submission of resolution	30th November 2022					
	plans						
17	Manner of submitting resolution plans to	Via sealed envelope or via email (should be password					
46	resolution professional	protected) as mentioned in the request for resolution plan.					
18		30th December 2022					
	resolution plan to the Adjudicating						
10	Authority for approval Name and registration number of the	Names Amit Conta					
13	resolution professional	Name: Amit Gupta Reg No.: IBBI/IPA-001/IP-P00016/2016-17/10040					
20	Name, Address and e-email of the	Name: Amit Gupta					
	resolution professional, as registered with	Address: 702, Janki Centre, Off Veera Desai Road, 29,					
1 1		Shah Industrial Estate, Mumbai City,					
		Maharashtra -400053					
		Email: caamith.gupta@gmail.com					
21	Address and email to be used for	Address: 702, Janki Centre, Dattaji Salvi Road, Off					
	correspondence with the resolution	Veera Desai Road, Andheri (west), Mumbai City,					
	professional Maharashtra - 400053						

For and on behalf of Shah Brothers Ispat Private Limite

Place: **Erode**

Date: 15.09.2022

ion Professional of Shah Brothers Ispat Private Limite IBBI Reg. no. IBBI/IPA-001/IP-P00016/2016-17/1004/ ess: 702, Janki Centre, Dattaji Salvi Road, Off Veera Dess Road, Andheri (west), Mumbai City, Maharashtra - 40005/ Email: caamith.gupta@gmail.con

Email: cirp.shahbrothers@rirp.co.in

Email: cirp.shahbrothers@rirp.co.in

caamith.gupta@gmail.con

16th September 2022

Mr. Amit Gupta

SALE OF PRATHYUSHA RESOURCES & INFRA PRIVATE LIMITED
(UNDER LIQUIDATION)
(Regulation 32, 32A and 33 of the Insolvency and Bankruptcy Board of India
(Liquidation Process) Regulations, 2016) read with Schedule I to
Liquidation Regulations

RELEVANT PARTICULARS

LINU.	RELEVANT PARTICULARS				
1.	Name of corporate debtor	Prathyusha Resources & Drivate Limited			
2.	Date of incorporation of corporate debtor	18/08/2005			
3.	Authority under which corporate debtor is incorporated / registered	Registrar of Companies – Vijaywada			
4.	Corporate Identity No. / Limited Liability Identification No. Of corporate debtor	U35111AP2005PTC047165			
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Door No. 25/40/12, Ganguavari Street, Near Laxmi Talkies, Visakhapatnam,Andhra Pradesh – 530 001			
6.	Liquidation commencement date of corporate debtor	04/07/2022			
7.	Name, registration number, address and email address of the Liquidator	Name: K. Sivalingam Registration No.: IBBI/IPA-001/IP-P01597/2018-19/12430 Registered Address: Flat No. 1603, Tulive Horizon Residences, Arunachalam Road, Saligramam, Chennai, Tamil Nadu – 600 093 Email: siva.k220353@gmail.com			
8.	Mode of Sale & Reserve Price	Mode of Sale - Sale of Corporate Debtor on Going Concern Basis Reserve Price – INR 3 Crores			
9.	Further details are available at or with	Email request to be sent to: irp.pripl@ibcprofessionalsolutions.com			
10.	Date of publication of Public Announcement for EOI	16/09/2022			
11.	Last Date for receipt of EOI Documents & EMD	25/09/2022			
2.	Tentative Auction Start Date	29/09/2022			
13.	Tentative Auction Close Date	30/09/2022			

Note: Nothing contained herein shall constitute a binding offer or a commitment to sell th orporate Debtor as a going concern or any of its assets.

The Liquidator reserves the right to amend and/or annul this invitation including any timelines he process therein, without giving reasons, at any time without assigning any reason or assum

nterested Bidders shall be shared the information about the Corporate Debtor vide secured lin along with the Detailed Invitation to be obtained from the liquidator vide email request

Date: 16/09/2022

Sd/- Mr. K.Sivalingan Liquidator of Prathyusha Resources & Infra Pvt. Ltd

Reg. No. - IBBI/IPA-001/IP-P01597/2018-19/12430



FINANCE DEPARTMENT, CHENNAI-9 **Auction of 10 years Tamil Nadu**

Government Stock (Securities)

- Government of Tamil Nadu has offered to sell by auction the date securities for an amount of Rs. 2000 crore with Ten year tenure Securities will be issued for a minimum nominal amount of Rs.10,000 and multiples of Rs.10,000/- thereafter. Auction which will be yield based under multiple price format will be conducted by Reserve Ban of India at Mumbai Office (Fort) on September 20, 2022.
- The Government Stock upto 10% of the notified amount of the sale will be allotted to eligible individuals and institutions subject to a maximum limit of 1% of its notified amount for a single bid as per the Revised Scheme for Non-competitive Bidding facility in the Auctions of State Government Securities of the General Notificatio (Annexure II). Under the scheme, an Investor can submit a single bid only through a Bank or a Primary Dealer.
- Interested Persons may submit bids in electronic format on the Reserve Bank of India Core Banking Solution (E-Kuber) System a stated below on **September 20, 2022**.
- a) The competitive bids shall be submitted electronically on the Reserve Bank of India Core Banking Solution (E-Kuber) System between 10.30 A.M. and 11.30 A.M.

b) The non-competitive bids shall be submitted electronically on the Reserve Bank of India Core Banking Solution (E-Kuber) System between 10.30 A.M. and 11.00 A.M.

- The yield percent per annum expected by the bidder should b expressed up to two decimal points. An Investor can submit more than one competitive bid at different rates in electronic format or the Reserve Bank of India Core Banking Solution (E-Kuber) System However, the aggregate amount of bids submitted by a Perso should not exceed the notified amount
- The result of auction will be displayed by Reserve Bank of India on its website on September 20, 2022. Successful bidders should deposit the price amount of Stock covered by their bids by mean of a Bankers' Cheque or Demand Draft payable at Reserve Bank of India, Mumbai (Fort) or Chennai on September 21, 2022 before the close of banking hours.
- The Government Stock will bear interest at the rate determined by Reserve Bank of India at the auction and interest will be paid hal yearly on March 21 and September 21. The Stock will be governed by the provisions of the Government Securities Act, 2006 and Government Securities Regulations, 2007
- The stocks will qualify for ready forward facility.
- For other details please see the notifications of Governmen Dated September 15, 2022. N. MURUGANANDAM

DIPR/961/Display/2022

Finance Department, Chennai-9. ... "சோதனை கடந்து சுதந்திரம் அடைந்தோம், சாதனை புரிந்து சரித்திரம் படைப்போம்

Additional Chief Secretary to Government

R.P.P INFRA PROJECTS LTD.

CIN: L45201TZ1995PLC006113

SF No. 454, Raghupathynaiken Palayam, Railway Colony Post, Poondurai Road, Erode - 638 007
Tel +91 424 2284077; Fax: +91 424 2282077, E-mail:secretary@rppipl.com, www.rppipl.com Notice of 27th Annual General Meeting and E-Voting Information

Member may note that the 27th Annual General Meeting (AGM) of R.P.P Infra Projec Limited ("the Company") will be held at the Registered Office of the Company at S I No. 454, RaghupathynaikenPalayam, Railway Colony Post, Poondurai Road, Erode 638 002, Tamil Nadu on Friday the 30th September 2022 at 2.00 P.M. and participation at the AGM shall be available through Video Conference (VC) Other Audio Visual Means (OAVM) facility, incompliance with all the applicable provision of the companies Act,2013 and Rules issued thereunder and Securities Exchange Board of India (SEBI) (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 read with the Ministry of Corporate Affair (MCA) General Circula No.02/2021 dated January 13, 2021 and General Circular and all other applicable circular No.10/2021 dated June 23, 2021 as further extended by circular No.3/2022 dated May 5,2022 issued by the MCA, SEBI and Government of India, to transact ousiness that will be set forth in the Notice of the AGM.

Dispatch of the Annual Report and Notice of the AGM: Compliance of above circular and In terms of sections 101 and 136 of the Act, read with the rules mad thereunder, the listed companies may send the notice of AGM and the annual report including financial statements, boards' report, etc. by electronic mode. Pursuant to th said provisions of the Act read with MCA Circulars, SEBI Circular dated May 13, 2022 Notice of Twenty-Seventh-AGM along with the Annual Report for FY2022 is being ser only through electronic mode to those members whose email addresses ar registered with the Company/depositories. Members may note that the Notice and Annual Report for FY 2021-22 will also be available on the Company's website a http://www.rppipl.com/and website of the stock exchanges i.e. BSE Limited a www.bseindia.com and National Stock Exchange of India Limited a www.nseindia.com and on the website of cameo at www.cameo.com.

Manner of Registering /updating email Address: Member who have not registered /updated their email addresses with the company's RTA and their DP are requeste to register their email address for limited purpose of receiving Annual report for the Financial Year 2021-22. Notice of the AGM and the login credentials for remot e-voting, by sending an email request on secretary@rppipl.com o murali@cameoindia.com along with Name, Folio Number /DPID-CLID, self atteste

scan copy of the PAN and AADHAR/Passport/Driving License. Manner of casting vote at the AGM: Member will have an opportunity to cast their

vote remotely or physically attending during the AGM.

Other: The voting rights of shareholders shall be in proportion to their shares of th paid up equity share capital of the Company as on 23rd September 2022.

For any guery or grievances in relation to e-voting, Members may write to / contact

Mr. Muralitharan, Cameo Corporate Services Limited "Subramanian Building", ' Floor, No.1, Club House Road Chennai – 600002, Phone: 044 28460390 or emai murali@cameoindia.com or at secretary@rppipl.com who will address th shareholder's grievances connected

The result of the e-voting / voting at AGM ballot shall be declared not later than 48 nours of the conclusion of the AGM, The Results declared, along with the Scrutinizer' Report, shall be displayed at the Registered Office of the Company and also be placed on the Company's website and communication to the Stock Exchanges where the Company's shares are listed.

For R.P.P Infra Projects Limited

A. Nithya

Whole Time Director/CFO



ગળપાદર જવા છકડામાં બેસતા અજાણ્યા ઈસમે વાહન હંકારી મુક્યું ગાંધીધામહાઈવેપર છરી બતાવી યુવાન પાસેથી ૨૫ હજારની લૂંટ

ઓરિએન્ટલ કાર્બન એન્ડ કેમિકલ્સ લિમિટેડ

કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર (સીઆઇએન): L24297GJ1978PLC133845 રજી. ઓફિસ : પ્લોટ નં. ૩૦-૩૩, સર્વે નં. ૭૭, નિશાંત પાર્ક,

નાના કપાયા, મુંદ્રા, કચ્છ, ગુજરાત-૩૭૦૪૧૫ ઇ-મેલ આઇડી: investorfeedback@occlindia.com; વેબસાઇટ: www.occlindia.com

नोटिस

(કંપનીના ઇક્વિટી શેરધારકોની જાણ માટે)

विषय : डंपनीना ઇंडियटी शेरो र्घन्येस्टर એજयुङेशन એन्ड प्रोटेंड्शन इंड (IEPF) ઓથોરિટીને ટ્રાન્સફર કરવા બાબત

आर्थी आ नोटिस र्एन्वेस्टर એજ્યુકેशन એન્ડ प्रोटेड्शन इंड ओथोरिटी (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬, સમયાંતરે સુધારા સહિત (આઈઈપીએફ નિયમો)ની જોગવાઈઓ અન્વયે પ્રકાશિત કરવામાં આવે છે. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૨૪(દૃ) સહિત વંચાણે લેતા ઉપરોક્ત નિયમો મુજબ, તમામ શેરો કે જેમના ડિવિડન્ડો કંપની દ્વારા જાહેર કરાયા હોય તેમનો દાવા કરવામાં આવ્યો ન હોય કે સતત સાત વર્ષ કે તેથી વધુ સમયગાળા સુધી બિનચુકવાચેલ હોય તેમને કંપની દ્વારા આઇઇપીએફમાં તબદીલ કરવાના હોય છે. નિયમોમાં નિર્ધારિત વિવિધ જરૂરિયાતો મુજબ, કંપનીએ આઈઈપીએફ નિયમો હેઠળ જેમના શેરો માટેના નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ (વચગાળાના) માટે ડિવિડન્ડો સતત સાત વર્ષ કે તેથી વધુ સમયગાળા સુધી બિનચુકવાચેલ કે બિનદાવાવાળા હોઈ યોગ્ય કાર્ચવાહી (ઓ) કરવા માટે આઇઈપીએફ ઓથોરિટીમાં તબદીલ થવાને પાત્ર છે તે સભ્યો સાથે કંપનીએ વ્યક્તિગત સંદેશાવ્યવહાર કરેલ છે. કંપનીએ આવા શેરધારકો અને શેરો જે આઇઇપીએફ ઓથોરિટીમાં તબદીલ થવા માટે ડ્યૂ છે, તેની

સચિ કંપનીની વેબસાઈટ www.occlindia.com ઉપર અપલોડ કરેલ છે. તમામ સંબંધિત સભ્યોને તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી અથવા તે પહેલા કંપની કે કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને જરૂરી દસ્તાવેજો આપી નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ તથા ત્યારબાદના ડિવિડન્ડોની રકમ ઉપાડી લેવા પુન: સૂચિત કરવામાં આવે છે, કે જેથી તે શેરો આઇઇપીએફમાં તબદીલ ન થાય. જો કંપની કે કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને ઉપરોક્ત સમયગાળા સુધી કોઈ પ્રત્યુતર મળતો નથી, તો કંપની નિયમોમાં નિર્ધારિત વિવિધ જરૂરિયાતોની પરિપૂર્તિ કરતા નીચે આપેલ ડ્યુ પ્રોસેસને અનુસરતા હવે કોઈ પણ નોટિસ આપ્યા વગર તમામ શરો આદીદીપીએકમાં તબદીલ કરશે.

- જો ભોતિક સ્વરૂપે શેર હોય તો : સંબંધિત સભ્ય વર્તી ડ્રપ્લિકેટ શેર સર્ટિકીકેટ જારી કરી તેમને આર્દાદાપીએફ ઓથોરિટીમાં ટ્રાન્સફર કરાશે.
- ર. **જો ડિમેટ સ્વરૂપે શેર હોય તો** : ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ્સની સહાયથી આઇઇપીએફ ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં શેરો સીધા ટ્રાન્સફર કરાશે. સંબંધિત સભ્યો બિનદાવાવાળા તથા આઇઇપીએફ ઓથોરિટીમાં ટ્રાન્સફર થયેલ શેરો એમ બન્ને માટે આઇઇપીએફ નિયમોમાં આપેલ કાર્યવાહી અનુસરીને દાવો કરી

જો કોઈ સભ્યને આ વિષયવસ્તુ અને નિયમો સંબંધે કોઈપણ પ્રશ્ન/સ્પષ્ટતા હોય તો તે માટે તેઓ કંપનીના રિજસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લિ., રૂમ નં. ૫૦૨ અને ૫૦૩, પાંચમો માળ, વૈષ્ણો ચેમ્બર્સ, દુ, બ્રેબર્ન રોડ, sोલકાતા ૭૦૦ ૦૦૧, ટેલિ. +૯૧ ૩૩ ૪૦૦૪ ૯૭૨૮/૧૬૯૮, ઈ-મેલ આઈડી : iepf.shares@linkintime.co.in પર સંપર્ક કરો.

આ નોટિસ કંપનીની વેબસાઈટ www.occlindia.com ઉપર જોઈ શકાય છે તથા સ્ટોક એક્સ્ચેન્જ લિમિટેડની વેબસાઇટો www.bseindia.com તથા www.nseindia.com પર પણ જોઈ શકાશે.

ખર્ચો

9667298812.

બ્યુટી પાર્લર

0040282518

ઓરિએન્ટલ કાર્બન એન્ડ કેમિકલ્સ લિમિટેડ વર્તી

50% છુટ, 15 કલાકમાં

લોનમાંથી.

ફાયનાન્સ, 2% વ્યાજ.

50% gz, 9667289913,

Daynight મસાજ છોકરી

સાથે કામ કરીને 20000

કમાઓ. 9730269268.

क्योतिष

શવ-કાલીકા જયોતિષ

કેલ્લો ઉપાય, 100% ગેરેટીથી સાથે 4 કલાકમાં ક

લવ-પ્રોબ્લેમ, પતિ-પત્નિ ઝઘડો

મેલીવસ્ત, ઘટાછેડા, એક તરફી પ્રેમ ात्रुनाश, NRI प्रोब्लेम, घंधामां ३डायट

બાકી રૂપિયા, ગૃપ્તદાનના જાણકાર,

ધારેલી સ્ત્રી, સ્ટ્રીંગ વશીકરણ સ્પે.

घरेलेहा डोईपछ समस्यानो समाधाः

રમશાબિક, તાંત્રિક, કાળી વિદ્યા દ્વારા, તાત્કાલીક કા

® 8758290210

多の INDIA'S NO.1 ゆ†

બાબા આચૂબ ખાન

रो. वशीकरण, मुरुचीट, व्लेक्सेजुड 3 क्टबाक्सां कील पर घरेजीडा श्टील बी श्टील समस्यानु १०१% समाधान धंधामां लिहिश, ब्ल मेरेंकु, प्रति-प्रत्नी अध्युक्ताव

हिन्दुवेश, **ख**ञ्ज, सीतन

દેવું, કોર્ટ-કેસ, વિદેશ યાત્રા, બિમારી વગેરે

7668835561.

રથળ : નોઇડા તારીખ: ૧૫/૦૯/૨૦૨૨

अन्य

30,000-

0040284331

0040284463

\$3.

8570896168.

Job રોજના

7016612002

Airport eg

0040284337

0040284327

0040284465

Priya

6999682698.

૧૦૦% એરપોર્ટમાં ડાયરેક્ટ

ભર્તી ૧૦ પાસ, સેલરી

ઘરેથી પેકીંગનુ કામ કરવા

માટે આપનુ નામ વોટ્સઅપ

એરપોર્ટ ડાયરેક્ટ ભર્તી

અનપઢ- ગ્રેજ્યુએટ છોકરા-

છોકરીઓ 25000- 85500 એરહોસ્ટેસ, સુપરવાઈઝર,

ડ્રાઈવર ગ્રાઉન્ડ સ્ટાફ,

રહેવાનુ, જમવાનું, બોનસ,

part

20000 કમાઓ (100%)

નોકરી અનપઢ- ગ્રેજ્યુએટ

3577 છોકરા- છોકરીઓ

44800- 82700 રહેવાનું,

જમવાનું, ફંડ, બોનસ,

ઈશ્યોરન્સ. 9711711493.

7496010607,

time

પાક્કી

9341239800.

90Y00.

પ્રણવ કમાર માઇટી કંપની સેકેટરી અને ગુએમ લિગલ

સામખિયાળી-મોરબી હાઈવે પર ડીઝલની ચોરી

સામખિયાળી-મોરબી રોડ પર આવેલ બાહુલ્ય એસ્સાર કંપનીના પેટ્રોલપંપ પર રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. તસ્કરોએ ટાંકામાં ડીપ લેવાની લાઈનમાં પાઈપ નાખી અંદરથી ૬૩૦ લિટર ડીઝલ, રૂપિયા ૫૮ હજારનું કાઢી લઈ પલાયન થઈ ગયા હતા.

લાકડિયા પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.૧૧/૯ ના રાત્રિના ૩ થી ૫:૩૦ વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો હતો. તાલુકાના સામખિયાળીથી મોરબી રોડ પર આવેલ બાહલ્ય એસ્સાર કંપનીના પેટોલપંપ પર રાત્રિના અરસામાં મેનેજર અને

કર્મચારી સુઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમો પેટ્રોલપંપ પર ધસી ગયા હતા. આરોપીએ ડીઝલ ટેન્કમાં ડીપ લેવાની લાઈનમાં પાઈપ નાખી અંદરથી ૬૩૦ લિટર ડીઝલ, રૂપિયા ૫૮,૧૮૦નું કાઢી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ બાદ સવારના ડીઝલના સ્ટોકની તપાસ કરતા તફાવત આવ્યો હતો. જેથી સીસીટીવી કેમેરામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો પેટ્રોલપંપમાં ડીપ લેવાની લાઈનમાં પાઈપ નાખી ચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પંપ સંચાલક બીરેન જયંતીલાલ જેઠવા, રહે, નવા કટારિયા, તા.ભચાઉની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

DAHOD SMART CITY DEVELOPMENT LIMITED

Dahod Smart City Development Limited (DSCDL) invites online E-Tenders for "Request for Proposal for Design Engineering, Procurement, Construction of DUDHIMATI RIVERFRONT development including beautification and infrastructure components at Dahod on Design Build and Operate basis including Operation and Maintenance of

Estimated Cost (In Rs.)	Rs.17.38 Cr/-
EMD (In Rs.)	Rs. 17,38,270/-
Tender Fee (In Rs.)	Rs. 18,000/-
Last Date for online Submission of Tender Document Date/Time	30/09/2022 up to 18.00 Hrs

GENERAL INSTRUCTIONS: (1) The tender document for this work can be downloaded from website www.nprocui com. (2) Other Details of NIT shall be seen on website. (3) Copy of Technical Bid including all drawings, data sheets and duly filled up formats excluding the Financial Bid along with original Tender Fee and Bid Security to be submitted to the Chief Executive Officer (DSCDL), Jilla Sewa Sadan, Chhapri, Dahod-389151, by RPAD/ speed post only on or before Date: 07-10-2022 up to 17.45 Hrs. Chief Executive Officer, DSCDL reserves the right to accept or reject any or all tenders without assigning any reason thereof. This Tender notice shall form a part of contract document Tender No. 01 of 2022-23 Chief Executive Officer

(મહિતી-દાહોદ-૨૨૨-૨૦૨૨) Email: infrahead@dahodsmartcity.in

UCO BANK

મુંદ્રા શાખા : પ્લોટ નં. ૧૦, ઓમ કોમર્શિયલ પાર્ક, ઝીરો પોઈન્ટની પાસે, અદાણી પોઈન્ટ, મુદ્રા - ૩૭૦૪૨૧ (કચ્છ), HONDURS YOUR TRUST SIM di. 02636 - 222206

આથી નોટીસ આપવામાં આવે છે કે નીચેના ઉધારકર્તા / જામીનદારોને તેમણે મેળવેલી ધિરાણ સવલતો જેમ કે કેડીટ લોન **ચુકો ઠોંક, ગાંધીઘામ** ઉધારકર્તા / જામીનદાર લીધેલ જેની મૂળ રકમ અને વ્યાજ ભરવામાં કસૂર કરેલ છે અને તેમની લોન નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વર્ગીકૃત કરવામાં આવી છે. તેમને નોટીસો સિક્યુરીટાઈઝેશન અને રીકન્ટસ્ટ્કશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ ની ક્લમ ૧૩(૨) અંતર્ગત તેમન 9ેલ્લા અને જાણીતા સરનામા ઉપર પાઠવવામાં આવેલ પરંતુ તે "Not Found/Left" રીમાર્ક સાથે પરત થયેલ છે. તેથી આ જાહેર નોટીસ મારફતે જાણ કરવામાં આવે છે.

ડીમાન્ડ નોટીસની તારીખ/બાકી લ્હેશા (રૂા.) શ્રીમતી સુમિત્રાદેવી ઓમપ્રકાશ અને શ્રી ઓમપ્રકાશ ઉદારામ इं।. ६,७६,५६५.८८ (३।. अव लाभ ઓગણએંસી હજાર એક્સો એકાણું પ્લોટ નં. ૯७, સર્વે નં. ૩૫૯, બાગેશ્રી ટાઉનશીપ - ૪, વરસામેડી, તાલુકો અને ઈઠ્યાસી પૈસા પુરા) વત્તા તા. રહ.૦૬.૨૦૨૨ ના સુધી (તા. ર્શાજાર, કરછ, ગુજરાત - ૩૯૦૧૧૦. (22400590009353) ૨૮.૦૨.૨૦૨૨ ના રોજ થી વ્યાજ સાથે)

તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીન અને વર્ણવેલ મિલકતનો રહેણાંક પ્લોટ નં. ૯૭ (એરીયાનું ક્ષેત્રફળ ૯૧.૯૮ સ્કે.મી.), સર્વે નં. ૩૫૯, બાગેશ્રી ટાઉનશીપ - ૪ થી જાણીતું, જે સ્થિત ગામ - વરસામેડી, તાલુકો અંજાર, જીલ્લો - કચ્છ, ગુજરાત (સેલ ડીડ મુજબ) ચતુઃસીમા : 🌑 ઉત્તરે પ્લોટ નં. ૯૮, • દક્ષિણે : પ્લોટ નં. ૯૬, • પૂર્વે : ૯.૧૪ મી. આતંરીક રોડ, 👁 પશ્ચિમે : ૧.૫૨ મી. લેન અને ત્યારબાદ બગીચો અને પ્લોટ નં. ૧.

स्थापर भिलकतोनुं पर्शन

નોટીસ બજવણી માટેના અન્ય પગલાં લેવાઈ રહયા છે ઉપરોક્ત ઉધારકર્તાને આથી આ નોટીસ પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસની અંદર બાકી રકમની ચૂકવણી કરવ જણાવવામાં આવે છે. તેમા કસૂર થતાં આ નોટીસની તારીખથી ૮૦ દિવસ પૂરા થયા બાદ સિકયુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયસલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ ની કલમ ૧ ૩ની પેટા કલમ (૪) મુજબ આગળ પગલાં ભરવામાં આવશે. સહી/-અધિકૃત અધિકારી

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત રાજય 💚 wao જાહેર નિધિદા નં. ૧૨ સને ૨૦૨૨-૨૦૨૩

ગુજરાત રાજ્યના રાજ્યપાલ વતી કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ સિંચાઈ વિભાગ પવનચક્કી કમ્પાઉન્ડ, કેમ્પ એરિયા, ભુજ-કચ્છ (ફોન નં. : ૦૨૮૩૨-૨૨૦૪૦૭) દ્વારા કન્સ્લટન્સી કોન્ટ્રાક્ટ માટે બીડ મંગાવવામાં આવે છે.

5H	કામનું નામ	અંદાજિત રકમ (રૂા. લાખમાં)	ન્યુનતમ બીકરની લાચકાત ૧. બીક ફી રૂા. ૨. ઇ.એમ.કી. રૂા. ૩. સમય મર્ચાદા ૪. સોલવંશી
٩	પ્રોવાઇકિંગ કન્સલટન્સી સર્વિસીસ ફોર રિપેર એન્ડ રેઇઝીંગ ઓફ બંઘારા/ ટાઇડલ રેગ્યુલેટર/ રિચાર્જ ટેંક્સ ઇન અંજાર એન્ડ મુન્દ્રા તાલુકા ઓફ કચ્છ કિસ્ટ્રિકટ (બીજો પ્રયત્ન)	¥6.¥¥	૧. ૨. ૧,૫૦૦.૦૦ ૨. ૨. ૫૦,૦૦૦.૦૦ ૩. ૮ 원원에 ૪. ૨. ૧૦.૦૦ લાખ
એ	બિડ કોક્યુમેન્ટ કાઉન લોક કરવાની છેલ્લી તારીખ	ता.२५/०૯/२०२२ १५:०० इलाइ सुधी	
에	ઓનલાઇન સબિમશનની છેલ્લી તારીખ	ता.२५/०૯/२०२२,१८:०० डलाड सुधी	
સી	દસ્તાવેજના ભૌતિક સબિક્ષશન માટેની છેલ્લી તારીખ	તા.ર७/૦૯/૨૦૨૨ થી તા.૦૪/૧૦/૨૦૨૨ ૧૮:૦૦ કલાક સુધી (કચેરી સમય દરમ્યાન) ઉપરોક્ત કામનું ભરેલ ટેન્ડર ફક્ત રિષ. પોસ્ટ એ.ડી./સ્પીંડ પોસ્ટ/કુરિયરથી કચેરીમાં રજૂ કરવાના રહેશે.	
કી	સંપર્ક કચેરી	કાર્ચપાલક ઇજનેરશ્રીની કચેરી, કચ્છ સિંચાઇ વિભાગ, પવનચકકી કમ્પાઉન્ડ, કેમ્પ એરિયા, ભુજ-કચ્છ. પીન નં. ૩૭૦૦૦૧. ફોન નં. (૦૨૮૩૨) ૨૨૦૪૦૭ EMALL: eekidbhj@gmail.com	
ย	પ્રિ-બીક મિટિંગ	પ્રિ-બીડ મિટિંગ તા. ૨૨/૦૯/૨૦૨૨ના રોજ ૧૨:૦૦ કલાકે કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, કચ્છ સિંચાઇ વિભાગ, પવનચકકી કમ્પાઉન્ડ,	

વધુ વિગતો અને બીડ ઓનલાઈન સબમિશન માટે, કૃપા કરીને વેબસાઈટ www.nwi nprocure.com ની મુલાકાત લો. (બામાબિ-કરઇ-કલ્ક-ર૦૨૨)

કેમ્પ એરિયા, ભુજ-કચ્છ. પીન નં. ૩૭૦૦૦૧.

અઘીક્ષક ઇજનેરશ્રીની કચેરી, કચ્છ સિંચાઇ

વર્તુળ, સિંચાઇ સદન, જયુબિલી ગ્રાઉન્ડની

બાજુમાં, ભુજ-કરછ. પીન નં. ૩૭૦૦૦૧.

होन नं. (०२८३२) २२०४०७

EMAIL: eekidbhj@gmail.com

ता.२५/०६/२०२२ना १८.०५ इसाडे

નિયામકશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ભારત સરકાર / રાજય સરકારની પોસ્ટ મેટીક શિષ્યવૃત્તિ/સહાય યોજનાઓનો અમલ Online કરવા બાબત

નિયામકર્ત્રી, આદિજ્ઞતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા ફસ્તકની નીચે મુજબની ચોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત યોર્ટલ મારફત (https://www.digitalgujarat.gov.in) કરવાનો શાય છે. મુળ ગુજરાત રાજ્યના ધો:૧૧-૧૨, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ., સ્નાતક, અનુસ્નાતક, પી.ચેચ.ડી સુધીના સરકાર માન્ય અલ્યાસકમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓત્રંસ્થાઓપ્યુનિવર્સિટીઓ)કોલેજો/I.T.I./સંસ્થાઓમાં અભ્યાસ કરતાં અનુસ્**ચિત જનજાતિના વિદ્યાર્થીઓને** કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઇ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓવિદ્યાર્થીનીઓ પાસેદ્રી ગત વર્ષની જેમ ચાલુ શૈકાણિક વર્ષ:૨૦૨૨-૨૩માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

- Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships
- Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships (Freeship Card Students Only) Post Matric Scholarship for ST Girls (Having annual Family Income more than 2.50 Lac)
- 2A. Post-Matric Scholarship For ST Girl s (Having annual family income more than 2,50 Lac) (Freeship Card/Medical Loan Student Only)
- Food Bill Assistance to ST Students

શહેરના રેલવે સ્ટેશનથી પડાણા

તરફ હાઈવે પર છકડામાં સવાર ૪

શખસોએ યુવાનને છરી બતાવી તેની

પાસેથી રોકડ, મોબાઈલ મળી રપ

હજારની મતાની લૂંટ કરી પલાયન થઈ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ

તા.૧૩/૯ ના રાત્રિના ૨:૩૦ વાગ્યાના

અરસામાં આ બનાવ બન્યો હતો. મૂળ

દિયોદર તાલુકાના વડિયા અને હાલે

મેઘપર બોરીચી પાસે લાકડાંની

લાતીમાં રહેતો ચંદ્રકાંત સોહનલાલ

વ્યાસ ટ્રેનમાં વતનમાંથી ગાંધીધામ

રેલવે સ્ટેશન આવ્યો હતો, ત્યારે ગેટ

પાસે છકડામાં ૪ ઈસમો તેની પાસે

આવી ગયા હતા. જેથી યુવાને છકડા

ચાલકને ગળપાદર જશો? તેમ કહેતાં

આરોપીએ હા પાડી હતી. યુવાન

છકડામાં બેસી જતાં આરોપીએ

ગળપાદર જવાને બદલે પડાણા તરફ

છકડો હંકારી મુક્યો હતો. યુવાન

ગભરાઈ જતાં છકડો રોકવા કહ્યું હતું.

તેવામાં છકડામાં સવાર ઈસમોએ છરી

બતાવી યુવાન પાસેથી રોકડ ૧૫,૩૦૦

તથા મોબાઈલ ફોન મળી રૂપિયા

રપ,૩૦૦ ની મતાની લૂંટ કરી યુવાનને

નીચે ઉતારી લુટારુ પલાયન થઈ ગયા

હતા. ઘટના બાદ યુવાન ભાઈ પાસે

દોડી ગયો હતો. બનાવથી હતભાત

બની જતાં યુવાન બીમાર પડી ગયો

હતો. આ દરમિયાન તબિયત બરાબર

થતાં આજે ફોજદારી નોંધાવી છે. જે

અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ

ધરી છે.

ગયા હતા.

- Swami Vivekanand Scholarship for ST Students studying in ITI Financial Assistance to Purchase of Instruments for Medical and Engineering Students
- Financial Assistance for 12th passed out ST student for the purchase of Tablet. Coaching Assistance for Competitive exam and additional tution Assistance during course of study

Fellowship Scheme for ST student studying in P.Hd. (will be started from Date:01/10/2022)

ાણિક વર્ષ:૨૦૨૨-૨૩ માટે અનુસ્ચિત જનજાતિના ધો:૧૧ તથા ૧૨, કોલેજાયુનિવર્સિટી/IT/ક્ષેસ્થાના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તા: ૧૫/૦૯/૨૦૨૨ થી તા:૨૨/૧૦/૨૦ સુપીમાં વેબસાઇટ https://www.digitalgujarat.gov.in પર Online અરજીઓ કરવા જણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને Online અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે "ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર અનુસ્ચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સુચનાઓ અને ચોજનાઓની વિગત" વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે.

- 🌛 સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal વેબસાઇટ પર Citizen તરીકે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નવુ રજીસ્ટ્રેશન આધાર નંબર, E-mail ID, મોબાઇલનં તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ ઘ્રારા કરાવવાનું રહેશે જે કાયમી આ પોટેલ માટે સાચવી રાખવાની રહેશે. રજીસ્ટ્રેશન વખતે E-mail ID અને મોબાઇલનંબર કરજીયાત હોવાથી વિદ્યાર્થીઓનું દmail ID અને મોબાઇલનંબર ફોવો ફરજીયાત છે. (સદરફ મોબાઇલ નંબર જ્યા સુધી શિષ્યવૃતિસફાય મળી ન જાય ત્યા સુધી ચાલુ ફાલતમાં રાખવા વિનંતી છે.) રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબર/બાધાર નંબર / E-mail IDને યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલ ફોય તેનો ઉપયોગ કરી પુનઃ Login કરી પોતાની પ્રોફાઇલ (My
- 🌛 🕏 વિદ્યાર્થીએ અગાઉ કિષ્ટિલ ગુજરાત પોર્ટલ પર પ્રીકાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ કોય (જેમ કે અગાઉના વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ ૨૦૧૯-૧૯, વર્ષ:૨૦૧૯-૨૦, વર્ષ:૨૦૨૦-૨૧, કે વર્ષ:૨૦૨૧-૨૨માં શિષ્યવૃતિ ચૌજના માટે ઓનલાઇન ઐપ્લાથ કરેલ હોચ, ટેબલેટ માટે અરજી કરેલ હોચ કે પૌદેલની અન્ય શિષ્યવૃતિ ચૌજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોચ) તેઓએ કરીશી રજીસ્ટ્રેશન કરાવવાનું રફેશે નફી. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી ચોજનામાં સીધી અરજી કરી શકશે.
- 🗲 🕏 વિદ્યાર્થીએ ગત વર્ષનો પોતાનો ID-Password લુલી ગયેલ ક્ષેય તે વિદ્યાર્થીએએ "Forget Password" પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાની રહેશે. નવી પાસવર્ડ મબ્યા બાદ પોતાની મોબાઇલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. "Forget Password" મેનુ ડિજિટલ ગુજરાત પીર્ટલપર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
- 🗦 😵 વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ ક્ષેય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ ક્ષેય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની SC/ST/OBC કચેરીનો સંપકે કરી પોતાની ઓળખ પસ્થાપિત કરી પોતાની પોકાઇલમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે.
- 0040284334 રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે:
 - 🕩 જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ઓનલાઇન અરજી કરેલ ફતી અને નિયમોનુસાર શિષ્યવૃતિ મેળવેલ ફતી તેવા વિદ્યાર્થીઓની યાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક "Renewal" મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનુ નથી "Renewal" બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો ચકાસી લેવાની રફેશે અને રીન્યુઅલ માટે જરૂરી એવી ગત વર્ષની માર્કશીટ, ફી ભર્ચાની પહોંચ વિગેરે અપડેટ કરી અરજી સેન્ડ કરવાની રહેશે. જો આવકના દાખલાને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોય કે આવકમાં કોઇ ફેરફાર થયેલ હોય તો તે પણ કરી અપલોડ કરવાના રહેશે.
 - 🌛 🕏 વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃતિ મળેલ ફતી અને તેનુ કોર્મ ચાલુ વર્ષે ઓટોમેટીક "Renewal" મીડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ "Request a New Service" મેનુમાં જઇને વર્ષ ૨૦૨૨-૨૩ માટે લાગુ પડતી યોજનામાં ફેશ શેર્મ ભરી અરજી કરવાની રહેશે. 🗲 જે અનુસચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ફેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપબ કરી *Login* મેનું પર ક્લીક કરી *Citizen Login*માં જઇ પોતાના Id-
 - Passwordથી લોગીન કરવાનું રહેશે. લોગીન કર્યા બાદ "Request a New Service" પર કલીક કરવાનું રહેશે ત્યારબાદ "Scholarship" Option મો જઇ "Select Financial Year" મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ સીલેક્ટ "ST (Scheduled Tribe)" ફેડિંગના નીચે દર્શાવેલ ચોજના પૈકી જે ચોજનામાં પાત્રતા ધરાવતા ફોચ તેના પર ક્લીક કરી એપ્લાચ કરવાનુ રહેશે. ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ધો: ૧૧/૧૨) / તમામ પ્રકારની કોલેજો/ યુનિવર્સિટીઓ / આઇ.ટી.આઇ./સંસ્થાઓએ કરવાની કાર્યવાફી:-
 - 🕩 ગત વર્ષે શાળા/કોલેજાસંસ્થા/TT એ જે ID-Passwordની મદદથી શિષ્યવૃતિ/સાધનસફાય/દેબલેટ/ ખાનગી ટ્યુશન સફાય યોજનાની કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરેલ હતી તે જ ID-Passwordની મદદથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩મા કામગીરી કરવાની રહેશે. કોઇ આચાર્યશ્રી પોતાનો પાસવર્ડ ભુલી ગયેલ હોય તો "Forgot Password" ઓપ્શનની મદદથી પાસવર્ડ બદલી શકાશે. (જો ક્રેષ્ઠ આચાર્યશ્રીનો મોબાઇલ નંબર બદલાવવાની જરૂરીયાત ઉભી થાય તો જિલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી બદલાવી શકાશે.). જો કોઇ શાળા/કોલેજ/સંસ્થા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રથમ વખત કામગીરી કરતા ફોચ તો નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.
 - કોલેજ કક્ષાની દરેક સસ્થાઓ માટે તેઓની By Default Login ID સંસ્થાની AISHE કોડ રહેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રફેશે. જે સંસ્થાઓ પાસે AISHE કોડ ન હોય તેમણે શિક્ષણ વિભાગની સંબંધિત કચેરી પાસેથી મેળવવાનો રફેશે. ધોરણ:૧૧-૧૨માં દરેક ઉચ્યત્તર માધ્યમિક શાળાનો DISE કોડ તેની Login ID રફેશે જ્યારે By Default Password જિલ્લા કક્ષાએથી મળેલ પરિપત્રમાં જણાવ્યા મુજબનો રફેશે. પ્રથમ વખત લોગીન થયા બાદ સંસ્થાએ Default પાસવર્ડ Change કરવાની રફેશે તેમજ પ્રથમ વખત લોગીન થયેથી તમામ કૉલેજાયૂનિવર્સિટીએ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની રફેશે અને કોલેજ / યૂનિવર્સિટીમાં જે કોર્ષ યાલતા ફોય તેની વિગતો અપડેટ કરવાની રહેશે. કોલેજ/યુનિવર્સીટી બ્રસ કોર્સની વિગતો અપડેટ કરવામાં આવશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને Online અરજી કરતી વખતે Website પર જે તે કોલેજ દેખાશે અને અરજીપત્રકો Online ભરી શકાશે જેની નોંધ લેવી.
 - 🗲 તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ / કોલેજો / યુનિવર્સિટીઓ / આઇ.ટી.આઇ/ સંસ્થાઓએ ઉક્ત ચોજનાઓ પૈકી લાગુ પડતી કેટેગરી જાતિ મુજબના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ થઇ શકે તે માટે સંસ્થા દ્વારા વિદ્યાર્થીના મોબાઇલ નંબર, ઇ-મેઇલ મારફત, વીટ્સએપ કોલ અથવા વેબીનાર જેવા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવવામાં રફેશે. .
 - 🗲 વિદ્યાર્થીઓની અરજી કરવાની કામગીરી બાદ તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા / કોલેજો / યુનિવર્સિટીઓ / આઇ.ટી.આઇ.બંસ્ચાઓએ પોતાના User ID/Passwordના આધારે ઉક્ત તમામ વિદ્યાર્થીઓના Online Applicationના Verificationની કામગીરી કરી Higher Authority એટલે કે સંબંધિત જિલ્લા કચેરીને Online Forward કરવાની રહેશે અને તમામ ફાર્ડકોપી સફિતની દરખાસ્તો જિલ્લા કચેરીએ જમા કરાવવાની રફેશે.
 - વધુ માહિતી માટે જિલ્લાકક્ષાએથી મળેલ પરીપત્રમાં આપેલ સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. નોંધ:-
 - 1. દરેક વિદ્યાર્થીએ પોતાની અરજી કરતા પહેલા તેઓના આધારનંબર જે બેંક એકાઉન્ટ જોડે લીંક (સીંડીંગ) કરાવેલ ક્ષેચ તે ચકાસીને તે જ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો
 - 💈 દરેક વિદ્યાર્થીએ પોતાનો આવકનો દાખલો સક્ષમ અધિકારીનો, જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો, આધારકાર્ક, બેંક પાસબુકનું પ્રથમ પાનું, તાજેતરનો પાસપીર્ટ સાઇઝનો ક્રોટો, ફ્રી ની રસીદ, પાસ કરેલ માર્કસીટ, ગેપ અંગેનું એફીડેવીટ (જો અભ્યાસક્રમમાં તૃટ હોય તો), ફ્રેસ્ટેલરનું સર્ટીફીકેટ "JPEG, "JPG, "JPF, "PDF ફ્રોરમેટમાં 200KB થી ઓછી સાઇઝમાં ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પછી જ ફોર્મ ભરવા બેસવું જેથી એક જ સમયે ફોર્મ ભરી શકાય.
 - 3. જે વિદ્યાર્થીઓએ રીશફલીંગમાં તમારો આ વર્ષનો ચાલુ અભ્યાસક્રમ છોડીને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ છે. અને અગાઉ સ્કોલરશીપનું ક્ષેમેં ભરાઇ ગયેલ છે તેવા કિસ્સામાં તમારૂ અગાઉ ભરેલ શેર્મ જો તમારા લોગીનમાંથી ક્લોઝ (close) કરવાનું રહેશે અને જો તે અરજી વ્યુ (View) ઓપ્શનમાં દેખાતી હોય તો જે તે શેલેજનો સંપર્ક સાધી તેને રીટર્ન કરાવી ક્લોઝ (close) કરવાની રહેશે. ત્યારબાદ તમે રીશકલીંગમાં પ્રવેશ મેળવેલ નવા અભ્યાસકમને ફોર્મ ભરી શક્શો.
 - 4. મૂળ ગુજરાત રાજ્યના અનુ.જનજાતિનાં વિદ્યાર્થી ક્ષેય પરંતુ ગુજરાત બહારના રાજ્યમાં પ્રવેશ મેળવેલ હોય તો તેઓએ શિષ્યવૃત્તિ યોજનાનું શેર્મ ભરતી વખતે Registration Details - Current Address માં તમારા અભ્યાસક્રમનાં રાજ્ય તથા જિલ્લાની વિગત ભરવાની રહેશે. તમારી સંસ્થાનાં AISHE code ની વિગત ઓનલાઇન ભરવાની રહેશે તથા સંસ્થાની માન્યતા, અભ્યાસ કમની માન્યતા, FRC ની Letter વગેરે જરૂરી આધાર-પુરાવા તમારા મૂળ વતનની જિલ્લા કચેરીમાં જમા કરવામાં આવશે
 - 5. રાજ્ય બહારની સંસ્થાઓએ તેઓના AISHE code સફિતની સંસ્થાની તમામ વિગત <u>quiaratscholarshiphelp@gmail.com</u> ઉપર મોકલવાની રફેશે.

(દીલીય રાણા IAS) નિયામક આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય, ગાંધીનગર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

એફ ઓનલાઇન ઓપનિંગની તારીખ

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમૃબેલા ચોજના પૈકી Post Matric Scholarship For OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ ચોજના અને અન્ય પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનો અમલ Online કરવા બાબત

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજય, ગાંધીનગર ખાતા ફસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા ચોજના પૈકી Post Matric Scholarship For OBC , EBC & DNT Students શિષ્યવૃત્તિ ચોજનાનો અમલ ઉજિટલ ગુજરાત પોર્ટલ મારકત (https://www.digitalgujarat.gov.in) કરવાનો થાય છે. વિકસતી જાતિના વિદ્યાર્થીએ માટે પોસ્ટ મેટ્રીક શિષ્ટવૃત્તિ ગ્રીજના અંતર્ગત ધો.૧૧-૧૨. ડિપ્લોમાં, આઇ.ટી.આઇ., સ્નાતક, અનુસ્નાતક, એમડીલ, પી.એચ.ડી કક્ષાના અભ્યાસ ક્રમ માટે (1) બીસીકે ૭૮ કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ (સા.શે.પ.વ.) (2) બીસીકે-૧૩૭ કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી શિષ્ટાવૃતિ (વિચરતી વિમુકત) , (3) બીસીકે-૮૧ કુમાર માટેની પોસ્ટ એસ.એસ.સી શિષ્ટાવૃતિ (સા.શે.પ.વ) (4) બીસીકે-૧૩૮ કન્યાએ માટેની પોસ્ટ એસ.એસ.સી શિષ્યવિત (વિચરતી વિમકત),(5) બીસીકે-૮૩ તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ ચોજના (સા.શે.પ.વ), (6) બીસીકે-૮૩ તકનીકી અને વ્યવસાચિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ ચોજના (આ.પ.વ) (7) બીસીકે-૮૩ તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ ચોજના (લધુમતી જાતિ) (છ) બીસીકે-૧૩૯ તકનીકી અને વ્યવસાચિક અભ્યાસકમ માટેની સ્વામી વિવેકાનંદ ચોજના (વિયરતી વિમુક્ત જાતિ) અને કેન્દ્ર પુરસ્કૃત (1) Post Matric Scholarship for OBC students અને (2) Dr. Ambedkar Post Matric Scholarship for EBC રાજય સરકારની ૮ અને ભારત સરકારની ૨ આમ, કુલ :૧૦ યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગોધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગોધીનગર દ્રારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમબેલા ચોજના પૈકી Post Matric Scholarship foi OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ ચોજનાનો અમલ કરવાનો થાય છે. જે અંતર્ગત રાજચની સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧૧ અને ૧૨ અને રાજચની સરકારી/ ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC, EBC& નક્કી થયેલ ગુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ:૨૦૨૨-ર૩ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ ચોજના તેમજ અન્ય નીચે મુજબની પોસ્ટ મેટ્ટીક શિષ્યવૃતિ ચોજના ફેઠળ પણ અગાઉના વર્ષોનો જેમ જ વર્ષ:૨૦૨૨-૨૩ મા વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, તથા વિચરતી-વિમુકત જાતિના વિદ્યાર્થીઓને નિચોમોનુસાર શિષ્યવૃતિ લાભ આપવા ઉજિટલ

- ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT Students शिष्यवृत्ति योष्टना

 - બીસેકે-૭૯ મેડીકલ,એન્જીયરીગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સફાય. ડી.એન.ટી-૨ મેડીકલ,એન્જીયરીગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સફાય
- બીસીકે-૯૮ એમ.કીલ.પીએચ.ડી વિદ્યાર્થીઓ માટેની કેલોશીપ ચોજના બીસીક-૯૧ સી ડૉ.બાબાસાફેબ ઓબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન ચૂનિવસિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ. બીસીક-૩ રપ સ્વર્ભિશર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહ્યયં.

ઘરાવતા વિદ્યાર્થીઓને તા: ૧૫/૦૯/૨૦૧૨ થી તા:૧૫/૧૦/૨૦૧૨ સુધીમાં શિષ્યા ક્લાની DBC,BBC,DNT જ્ઞાતના પાત્રતા https://www.digitalgujarat.gov.in પર Online અરજીઓ કરવા જણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને Online અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માર્ટિની માટે 'કિજિટલ ગુજરાત પોર્ટલ પર અનુસ્ચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યુવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સુચનાઓ અને ચોજનાઓની વિગત વાંચવાની રહેશે જે કિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કાઉનલોડ કરી શકાશે.

- A. વિદાર્શિઓ અરજી કરતા ધ્યાને લેવાના મુદ્દા ★ પૃથમ વિદ્યાર્શીઓએ મુદ્દા કાર્કાદલ વુંકતા મહાર માત્ર કહેવાનું રહેશે. જે કરવાનું રહેશે. જવું રજીસ્ટ્રેશન આધાર નંબર, E-mail ID, મોબાઇલનં તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ હારા કરવાનું રહેશે. જે કાથમી આ પોર્ટલ માટે સાચવી રાખવાના રહેશે. રજીસ્ટ્રેશન વખતે E-mail ID અને મોબાઇલ નંબર કરજીયાત છે. (સદરહું મોબાઇલ નંબર જ્યા સુધી સંપૂર્ણ અભ્યાસકમની શિધ્યવૃત્તિ/સહાય મળી ન જાય ત્યા સુધી ચાલુ રાખવા વિનતી છે.) રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબર આધારનંબર કે Email ID ને પોતાના Username તરીકે તથા જે Password બનાવેલ હોય તેનો ઉપયોગ કરી પુન: Login કરી પોતાની પોકાઇલ (My Profile) Update કરવાની રહેશે. (My Profile Update થયેલ ન હોય તો પણ વિદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકે છે.)
 ★ વિદ્યાર્થીએ અગાઉ કિલ્ટલ ગુજરાત પોર્ટલ પર પોકાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય ઉપ કરેમ કે અગાઉના વર્ષમાં સદરહું પોર્ટલ મારફત શિધ્યવૃત્તિ યોજનાઓમાં સામ બે એનલાઇન એપ્લાય કરેલ હોય તે પણ વિદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકે છે.)
 ★ વિદ્યાર્થીએ એન સાથે એનલાઇન એપ્લાય કરેલ હોય. તે બહેલ માર્ટ અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિધ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ કરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી. તેઓ આઉનિ Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી ચરજી કરી શકશે.
 ★ ઉદ્યાર્થીઓ ગત વર્ષની પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીએ 'Forget Password' પર કલીક કરી પોતાના રજીસ્ટર્ક મોબાઇલ પર OTP મેળલી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે, નવો પાસવર્ડ મબ્યા બાદ પોતાનો મોબાઇલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. "Forget Password" એપ્શવ કે કોઇ કારણસર બંધ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.

- જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગરોલ હોય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓએ અત્રેની કચેરી ફસ્તકની સંબધિત જિલ્લાની વિકસતી જાતિ જિલ્લા કચેરીનો સંપર્ધ કરી પોતાની ઓળખ પુસ્થાપિત કરી પોતાની પોડાઇલમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે. કિજેટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ "Scholarship" Option પર ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે. અન્ય કોઇ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ચોજનામાં એપ્લાય કરી શકશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
- નીધ લેવાની રહેશે. "Scholarship" Option પર ક્લિક કર્યો બાદ "Financial Year" ડ્રીપ ડાઉન મેનુમાં યાલુ વર્ષ માટે ઓનલાઇન અરજી કરવા માટે "Financial Year" ડ્રીપ ડાઉન મેનુમાં વર્ષ: ૨૦૨૨-૨૩ જ સીલેક્ટ કરવાનુ રહેશે. Year" ડ્રીપ ડાઉન મેનુમાં વર્ષ: ૨૦૨૨-૨૩ જ સીલેક્ટ કરવાનુ રહેશે. વિચરતી-વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ કાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓએ કરજિયાત "બા.સી.કે. ૩૨૫ સેલ્ફ કાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓઓ ચરજીની હોઠકોપી સહિતની દરખાસ્તો કરજિયાત વિકસતી જાતિની જિલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે.
- કરજિયાત વિકસતી જાતિની જિલ્લા કરેરીએ જમા કરાવવાની રહેશે. કેન્સ પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scholarship For OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ ચોજનાઓ અંતર્ગત વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પણતવર્ગ, આર્થિક રીતે પણતવર્ગ, અમાન પ્રદેશ કરી પણતવર્ગ, હતા સામા ચોલ્લા અધ્યાન કરી "Login" મેનુ પર ક્લીક કરી "Citizen Login/Registration" Optionમાં જઇ પોતાના લે-Passwordથી લીગીન કરવાનું રહેશે. લીગીન કર્ચ બાદ "Scholarship" Option પર ક્લીક કરી "Request a New Service" બટન પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ "કરાન પર ક્લીક કરી માના પર ક્લીક કરી માના પર ક્લીક કરી માના રહેશે. આ પ્રદેશ આપતા પત્ર તામાં પત્ર તા પત્ર સ્ત્રી કરતી કરી કરી માના રહેશે. ચોજના પંત્ર તા પત્ર તામાં પ્રત્યાના હ્યાર્થીએ માના રહેશે. ચોજનામાં પત્ર પ્રત્યાન સ્ત્રી સાથક પ્રવાસ કરવાનું રહેશે. ચોજનામાં પત્ર વર્ગ પત્ર તામાં પ્રત્યાન પ્રત્યાન પ્રત્યાન પ્રત્યાન સ્ત્રી કરવાના રહેશે. (લિદ્યાર્થીઓએ એર્શજનલ ચીલ્લા પ્રત્યાન સ્ત્રી કરવા) તમામ વિગતોની ચકાસણી અને ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે. (લિદ્યાર્થીઓએ એર્શજનલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલીડ કરવાનો રહેશે અને પરેપુર અરજીપત્ર કરારા ગાઢ્યા બાદ પત્રાના મોનાની તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલીડ કરવાના રહેશે જેશી વિદ્યાર્થીની અરજી પત્ર કાર્યા કારણ ગાઢ્યા અરજી સાથે બાદ્યા પત્ર ભાગ માના સ્ત્રી અલ્લાઇન અરજી શરા અપલીડ કરવાના રહેશે જેશી વિદ્યાર્થીની અરજી સબ્લીલ શાળા/કોલેજ/સંસ્થાના લોગીનમાં ઓનલાઇન સ્ત્રાના રહેશે.
- B. સરકારી <mark>અને ગાંટ-ઇન-એઇડ</mark> ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ધો: ૧૧/૧૨) તથા તમામ કોલેજો/ યુનિવર્સિટીઓ /આઇ.ટી.આઇ./સંસ્થાઓએ કરવાની કાર્યવાદીઃ-
- ગત वर्षे शाणा/डोलेश्व/युनिवर्सिटी/ITI/संस्थाये श्र ID-Passwordनी महहथी शिष्यवृत्ति/सहाय/टेजलेट योशनानी डामगीरी डिन्डिटल
- જોવા મળશે અને અરજીપત્રકો Online ભરી શકાશે જેની નોંધ લેવી. સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ/ખાનગી 171એ પોતાની ID Password પોતાની રીજીઓનલ ઓફીસ (RDD) પાસેથી લેવાનો રહેશે. તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ/ કોલેજો/ ચુનિવર્સિટીઓ/ આઇ.ટી.આઇ/ સંસ્થાઓએ ઉક્ત ઘોજનાઓ પૈકી લાગુ પડતી કેટેગરી જાતિ મુજબના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ ટઇ શકે તે માટે સંસ્થાના નોટીસ બોર્ડ પર ઘોજનાની માહિતી પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓના ધ્યાને પર લાવવા વિનંતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની અરજી કરવાની કામગીરી બાદ તમામ ઉચ્ચતર માધ્યમિક શાળા/ કોલેજો/ યુનિવર્સિટીઓ/ આઇ.ટી.આઇ./સંસ્થાઓએ પોતાના User ID/Passwordના આધારે ઉક્ત તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન અરજીના Verificationની કામગીરી કરી Higher Authority એટલે કે સંબંધિત જિલ્લા કથેરીને Online Forward કરવાની રહેશે. વધુ માહિતી માટે આચાર્યશ્રીઓએ જિલ્લાકક્ષાએથી મહેલ પરીપત્રમાં આપેલ સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

(ઍન.એ.નિનામા IAS) નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય, ગોધીનગર

(માહિતી/૧૪૦૭/૨૨-૨૩)

જનલસ્મી આધારકાર્ડ, પ્રોપર્ટી, બિઝનેસ તમામ

0040284419 इायनान्स પર્સનલ. 6397285477, 8433101939. 0040284343

EIR GISI BAMS, BHMS, BUMS, BDS, D. Pharma इायनान्स 9893869473.

> વાંચકોએ નોંધ લેવી કે કોલ ાણ અહેરખબરમાં જણાવેલ માહિતીની સત્થતા બાબતે અમ કોઈ બાંચેઘરી આપતા નથી વાંચકોએ પોતાની રીતે પૂરત यङासधी डरीने योग्य निर्धय લેવાનો રહેશે.

માહિતી/૧૪૦૮/૨૨-૨૩



